#### JINDAL HOTELS LIMITED



Date: 28th August, 2023

To, DSC-CRD BSE Limited, Code No. 7918 25<sup>th</sup> Floor, Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001

#### Scrip Code No. 507981

Sub: Submission of publication of advertisement regarding 38<sup>th</sup> Annual General Meeting of Shareholders of Jindal Hotels Limited in the newspapers (Pre-dispatch)

Re.: Intimation under Regulation 30 and all other applicable regulations, if any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 read with Schedule III - Part A - Para A of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, please find enclosed herewith the copies of newspaper advertisement (pre-dispatch) published in Business Standard (English language newspaper having Nationwide Circulation) and Vadodara Samachar (Gujarati language newspaper) at Vadodara, Gujarat, on Monday, 28<sup>th</sup> August, 2023, in compliance with Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 5, 2020 and other circulars in this regard, latest being General Circular No. 10/2022 dated December 28, 2022, intimating that 38<sup>th</sup> Annual General Meeting (AGM) of Jindal Hotels Limited will be held on **Tuesday, September 26, 2023 at 4.30 p.m.** (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

Kindly take this information on record and oblige.

Thanking You,

For Jindal Hotels Limited,

Mansi Vyas Company Secretary Encl.: As Above

#### SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES THROUGH E-AUCTION

Date of E-Auction : 29.09.2023 | Date & Time of Inspection : 22.09.2023 (Between 11.00 AM to 4.00 PM) EMD should be deposit by E-Auction Time

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 read with provison to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the constructive/physical/symbolic possession of which has been taken by the Authorised Officer of the Bank/ Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 29.09.2023 from 11:00 AM to 04:00 pm with 10 minutes extension if necessary for recovery of its dues due to the Bank/ Secured Creditor from the respective borrower (s) and guarantor (s). The reserve price and the earnest money deposit will be as mentioned in the table below agains

Ľ	11010	spective properties.						
	Sr. No.	Name of Branch	SCHEDULE OF THE SECURED ASSETS	A) Dt. Of Demand Notice u/s 13(2) of SARFAESI ACT 2002	A) Reserve Price	Details of the encumbrances		
		Name of Account	Description of the Immersable	B) Outstanding Amount	B) EMD	known to the secured		
П		Name & address of the	Description of the Immovable Properties Mortgaged / Owner's Name	as on				
II		Borrower / Guarantors Account	(Mortgagers of property(ies)	C) Possession Date u/s 13(4) of SARFAESI ACT 2002	C) Bid Increase	creditors		
				D) Nature of Possession Symbolic/Physical/Constructive	Amount (All Amt. in Lacs)	Property ID :		
	1.	PNB : Vesu (221910)	050 - 4 1 - 00 00		A) Rs.17.55	Not Known		
		Mrs. Hinal Hemant Kudiyanwala (Borrower) & Mr. Hemant Kudiyanwala	on 1st Floor of Building No.13 of Sneh Sarita Co-Op Housing Society Ltd. constructed on the land bearing Plot No.9 of Rev. S No.275, 276, 277/2 & 278 Paiki, T.P. Scheme No.13 (Adajan) F P	B) Rs.11,92,235.86	B) Rs.1.76			
		(Co-borrower) : Flat No. 104, 1 <sup>st</sup> Floor, Building No.13, Sneh Sarita Co-Op Housing Society Ltd., Adajan, Surat-395009		+ Further Interest + Expenses thereon	C) Rs.0.10			
			No.84-B at Village Adajan, Surat City, Sub District, Dist.Surat. Owner Mrs. Hinal Hemant Kudiyanawala (Symbolic Possession)	C) 02.08.2023	,	DUNDOGAGAG		
			North : Flat No.103, East : Society Land, South : Society Land, West : Stair Cabin.	D) Symbolic Possession		PUNB221910 HNLKUD		
	2.	PNB : Vesu (983900)	All that piece and parcel of the property bearing Plot No.111 (as per plan Plot No.111/A + 111/B) admeasuring about 79.31 sq mtrs	A).07.06.2023	A) Rs.58.35	Not Known		
		Mr. Dudabhai Bavubhai Bambhania (Borrower) & Mrs. Parvatiben Dudabhai	plan First No. 117/8 + 117/8/ authorstudy about 79.51 sq films together with undivided proportionate share in road and COP admeasuring 44.46 sq mtrs total admeasuring about 123.76 sq. mtrs together with construction thereon admeasuring 66.91 sq.	B) Rs.40,34,753.20 + Further Interest	B) Rs.5.84			
		Bambhania (Co- borrower) Plot No.111, Laxmi Park Raw House,		+ Expenses thereon	C) Rs.0.10			
		Near Dhruy Park, Near Gyan Jyot School, mtrs at 'Laxmi Park Row House'	mtrs at <b>'Laxmi Park Row House'</b> situated on the land bearing Rev. S. No.14 its Block No.23 admeasuring about 28025.00 sq. mtrs T.	C) 21.08.2023	0, 110.0.10			
		Mr. Valjibhai Bavbhai Ahir (Guarantor) 3A, Harekrishna Nagar, Opp. Capital Square Parvat Gam, Surat-395010	P. Scheme No.61 (Parvat-Godadara) FP No.70/A situated at village	D) Symbolic Possession		PUNB983900 Dadubambh		

TERMS AND CONDITIONS: The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002 and to the following further conditions: 1. The properties are being sold on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS" and "WHATEVER THERE IS BASIS". 2. The particulars of Secured Assets specified in the Schedule hereinabove have been stated to the best of the information of the Authorised Officer, but the Authorised Officer shall not be answerable for any error, misstatement or 3. The Sale will be done by the undersigned through e-auction platform provided at the Website https://www.mstcecommerce.com on date 29.09.2023 between 11 am to 4 pm. 4. For detailed term and conditions of the sale, please refer www.ibapi.in, www.tenders.gov.in, www.mstcecommerce.com. https://eprocure.gov.in/epublish/app. STATUTORY SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

Chief Manager, Authorised Officer, Punjab National Bank, Secured Creditor



बैंक ऑफ़ बड़ौदा Regional Office, Bank of Baroda Surendranagar Region CORRIGENDUM

Please refer **"Tender Notice"** of Requires Premises at Morbi Published in Business Standard Dated 23.08.2023. in this connection please read the Correct Last Date fo Submission of bid is 13.09.2023 up to 3 pm on or before. (Instead or 11.09.2023). All other contents remai unchanged. Regional Head, Surendranagar Regior

Mother Dairy Calcutta P.O.- Dankuni Coal Complex Dist: Hooghly, Pin - 712310

Ref. No.: WBMDC/PUR/23-24/ TENDER-027 Dated- 25.08.2023 Mother Dairy Calcutta invites e-tender offer(2<sup>nd</sup> call) for supplying of "Aluminium Foil Lid". Please visit: www.motherdairycalcutta.com & www.wbtenders.gov.in for e-Tender details. Last date of uploading of online offer is

12.09.2023 upto 03.00 P.M.

Chief General Manage

**NOTICE TO SHAREHOLDERS** 

[CIN: L24110MH1994PLC076156] Registered Office: E/27, Commerce Center 78, Tardeo Road, Mumbai-400034 VIDHI Phone No.: 022-6140 6666; Fax No.: 022- 23521980 Website: https://vidhifoodcolors.com/; Email id: mitesh.manek@vidhifoodcolors.com

TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION AND PROTECTION FUND embers are hereby informed that in terms of Section 124 of the Companies Act, 2013 and the IEPI

VIDHI SPECIALTY FOOD INGREDIENTS LIMITED

Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('IEPF Rules'), as amended, Equity Shares of the Company, in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) of the Government of India. Unclaimed or unpaid dividend for the  $2^{nd}$  Interim Dividend for the financial year 2016-17 is presently lying

with the Company and in terms of the IEPF Rules, the concerned Members are being provided an opportunity to claim such dividend for the financial year 2015-16 and onwards by sending a letter under their signature so as to reach at the Registered Office of Registrar and Share Transfer Agent (R&TA) of he Company, Link Intime India Private limited at C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumba 400083 on or before December 18, 2023 (2nd Interim Dividend for FY 2016-17). The details viz. names of the concerned Members, their folio number/DPCLID, the number of shares for transfer to the IEPF and due date are available on the Company's website at <a href="https://vidhifoodcolors.com/">https://vidhifoodcolors.com/</a>; under 'Investors' section. It may kindly be noted that if no valid claim is received by the R&TA by above mentioned dates, the Company shall take action towards transfer of such shares to IEPF thereafter. Once these shares are transferred to the IEPF by the Company, such shares may be claimed by the concerned Members only from the IEPF Authority by following the procedure prescribed under the IEPF Rules. It may also be noted that as per IEPF Rules all subsequent corporate benefits that may accrue in relation to the above shares will also be credited to the IFPF Demat Account.

Individual letters in this regard have been sent to the concerned Members at their latest registered addresses available with the Company/ R&TA. Clarification on this matter, if required, may be sough from the R&TA by sending email at <a href="mailto:rnt.helpdesk@linkintime.co.in">rnt.helpdesk@linkintime.co.in</a> or by calling them at 022-49186270. For Vidhi Specialty Food Ingredients Limited

Vishakha Pandva Date: August 26, 2023 Company Secretary Place: Mumbai Membership No. A59436

#### IN THE HIGH COURT OF JUDICATURE AT MADRAS (Ordinary Original Civil Jurisdiction)

Company Appeal No. 1 of 2021

. Mr. Shalibhadra S.Shah

P. Mrs. Vimlaben S.Shah Represented by the Power of Attorney Mr. Shalibhadra S.Shah B. Mrs. Darshana S.Shah All residing at No. 125/3, Satyagruh Society, Near Satellite Ahmedahad – 380 015.

1. M/s Sterlite Industries (India) Ltd, B-104, Waluj MIDC Industrial Area, Waluj District

2. PCS Industries Ltd, Plot No 148-151, Alandi Market Road, Alandi, Village – Dhanora, Dist Pune - 412 106.

3. Sharepro Services, Satam Industrial Estate, 3rd Floor, Cardinal Gracious Road, Chakala Andheri (East) Mumbai – 400 099.

**1. Mr. Suketu Bhai A.Shah,** 18 B, Captial Comm Center, Near Sanyas Ashram, Ashram Road

5. Mr. Pallar Passi, B No.125, Sattyagraha, Chawanni Co-op Hsg Society, Satellite

Ahmedahad – 308 054 6. Mr.Kanubhai N Shah, B No.125, Sattyagraha, Chawanni Co-op Hsg Society, Satellite

Ahmedabad – 380 054. 7. Mr.Jaggu Thakur, B No.125, Sattyagraha, Chawanni Co-op Hsg Society, Satellite

Ahmedabad – 380 054. 8. Mrs. Subhadraben J. Devta, B No.125, Sattyagraha, Chawanni Co-op Hsg Society ...Respondents

Satellite, Ahmedabad – 380 054. **Notice of Appearance** 

The Hon'ble Madras High Court by its Order dated 07.08.2023 made in the above Company Appeal has directed the Appellants/ Petitioners to cause notice of appearance by paper publication in relation to 3rd& 4th Respondents as shown above. Therefore, take notice that the above case would be listed for hearing on 04.09.2023 at about 10.30 A.M. or thereafter before Hon'ble Madras High Court for appearance of the 3rd& 4th Respondents either in person or through counsel, failing which the matter may be heard and decided in thei

Dated at Chennai this 23rd day of August, 2023

B. Dhanaraj, B.A., B.L., (Advocate) Counsel for Appellants9A, Tarapore Tower Door No. 826, 1st Floor, Anna Salai, Chennai – 600 002



#### JINDAL HOTELS LIMITED

CIN: L18119GJ1984PLC006922 Read. Office: GRAND MERCURE Vadodara Surya Palace, Sayajigunj Vadodara - 390 020. **Phone**: 0265-2363366 / 2226044 / 2226000 Email ID: share@suryapalace.com Website: www.suryapalace.com

#### NOTICE

- 1. The Thirty Eight Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Tuesday, 26th September, 2023 at 04:30 p.m. (IST), in compliance with all the applicable provisions of the Companies Act. 2013 and the Rules made thereunder as well as the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ('LODR') read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020, General Circular No. 02/2021 dated 13th January, 2021. Circular No. 2/2022 dated 5th May 2022 and Circular No. 10/2022 dated 28th December 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI ("relevant circulars") inter alia allowing to conduct Annual General Meeting (AGM) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) and dispensing with the personal presence of members, to transact the business set out in the Notice calling the AGM. Members will be able to attend the AGM through VC / OAVM. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act. 2013.
- In compliance with the relevant circulars, the Notice of the AGM and the standalone financial statements for the financial year 2022-23, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent to all the Members of the Company whose email addresses are registered with the Company / Depository Participant(s). The aforesaid documents will also be available on the Company's website at www.suryapalace.com and on the website of the Stock Exchange, i.e. BSE Limited at www.bseindia.com
- Manner of casting vote(s) through e-voting:
- (a) Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").
- (b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialised mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company at www.suryapalace.com
- (c) The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.
- Manner of registering / updating email addresses:
- (a) Members holding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company, are requested to visit the website of the Company's Registrar at https://linkintime.co.in/EmailReg/Email\_Register.html or write to them at vadodara@linkintime.co.in (email address) and upload / attach details of folio no. and self attested copy of PAN card.
- (b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their email addresses with their Depository Participants, are requested to register / update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts.
- Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or through e-voting during the AGM.

For Jindal Hotels Limited Date: 25.08.2023 Mansi Vyas **Company Secretary** Place: Vadodara

## THOFC BANK

#### **E-AUCTION SALE NOTICE HDFC** Bank Ltd.

Date: 28.08.2023 | Place: Surat

Branch: HDFC BANK LTD., Unit No. 101-105, 1st Floor, The Spire Building, Nr. Ayodhya Chowk, 150 Ft. Ring Road, Rajkot – 360007. Tel: 1800-210-0018

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Whereas the undersigned being the Authorised Officer of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Horbital Nacra (2023) (HDFC) under the Security Interest (Enforcement of Security Interest Act, 2002 (The Act) and in exercise of power conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement Plaules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act admit rule 3 of the Security Interest (Enforcement Plaules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act admit rule 3 of the Security Interest (Enforcement Plaules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act admit rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act admit rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act admit rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act and a spice and a spic

 direct control and contained of the care, please folds to the link provided in fibrior of control of the care in fibrior of the care in f						
Sr. No. No. Successor(s) and Assign(s) of the respective Borrower(s) / Mortgager(s)/ Successor(s) and Assign(s) of the respective Borrower(s) / Mortgagor(s) / Guarantor(s) (since deceased), as the case may be	Description of the Immovable Property / Secured Asset (1 Sq. mtr. is equivalent to 10.76 Sq. ft.)	Type of Possession	Reserve Price (Rs.)	Earnest Money Deposit (Rs.)	Date of Auction and time	

		Successor(s) and Assign(s) of the respective Borrower(s) / Mortgagor(s) / Guarantor(s) (since deceased), as the case may be.	(Secured Debt) (Rs.)*	(1 Sq. mtr. is equivalent to 10.76 Sq. ft.)	Possession	Price (Rs.)	Deposit (Rs.)	and time
١٢		(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
	1	MR. ATULBHAI J. VORA (Borrower) LOAN A/C No. 602960495	Rs.11,46,286/- as on 30 Nov., 2021*	All That Piece And Parcel of Immovable Property Being Flat No. 103 on 1st Floor, Admeasuring 37.48 Sq. Mtrs. of Built-Up Area & Attached Balcony Area About 19.54 Sq. Mtrs., Admeasuring 90.80 Sq. Mtrs. of Super Built-Up Area, In The Scheme Called "Vandan Appartment" Situate, Lying And Being At Revenue Survey No. 1399P, Whereby The Individual Plots Are Developed And Out Of So Many Plots, Sub-Plot No. 96/1, 96/2, Situated In The Area Known As Shruti Park, B/h. Hariya College, Within Limits Of Village: Jamnagar, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-Registration District: Jamnagar Within The State Of Gujarat.	Physical Possession	8,70,000/-	87,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	2	MR. BABU LAL (Borrower) LOAN A/C No. 638876564	Rs.21,59,047/- as on 28 Feb., 2022*	All That Piece And Parcel Of Immovable Property Being Residential House On Sub Plot No. 5/2, Of Plot No. 5 (Original Plot No. 5 to 7 Before Amalgamation) Admeasuring Land Area About 55.68 Sq. Mtrs., Along With Construction Standing Thereon Land, Situate, Lying And Being At Revenue Survey No. 158/3/P1, Whereby The Individual Plots Are Developed And Known As "Nandan Park", Situated B/H. Digjam Woolen Mill, Within Limits Of Village: Jamnagar, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-registration District: Jamnagar, Within The State Of Gujarat.	Physical Possession	17,20,000/-	1,72,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	3	MR. RAMESH RAJABHAI GHEDIA (Borrower) LOAN A/C No. 610101079, 630706117 And 617670859	Rs.14,77,455/-, Rs.3,88,607/- and Rs.4,22,714/- respectively as on 30-Nov.,2021*	All That Piece And Parcel Of Immovable Property Being Residential House On Sub Plot No. 49/2, Of Plot No. 49, Land Area About 63.00 Sq. Mtrs., Along With Construction Standing Thereon Land, Situate, Lying And Being At Revenue Survey No. 1333/1P, Whereby The Individual Plots Are Developed And Known As "Sardar Park-1", Situated Nr. Sandhiya Pul, Hariya College Road, Within Limits Of Village: Jamnagar, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-registration District: Jamnagar, Within The State Of Gujarat.	Physical Possession	14,50,000/-	1,45,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	4	MR. GOVINDBHAI KHIMABHAI KHODBHAYA (Borrower) LOAN A/C No. 608111819	Rs.17,39,590/- as on 30 Jun.,2021*	All That Piece And Parcel Of Immovable Property Being Flat No. 502 On 5th Floor, Admeasuring 33.31 Sq. Mtrs. Of Built-up Area & Admeasuring 98.47 Sq. Mtrs. Of Super Built Up Area, In The Scheme Called "Aum Residency" Situate, Lying And Being At Revenue Survey No. 91 & 95, Whereby The Individual Plots Are Developed And Out Of So Many Plots, Sub-plot No. B/4, Situated In The Area Known As "Kailash Nagar Street No. 5", Opp. S T Bus Stand, Within Limits Of Village: Jamnagar, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-registration District: Jamnagar Within The State Of Gujarat.	Physical Possession	16,00,000/-	1,60,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	5	MR. NITESH MULJIBHAI MANGE (Borrower) MRS. JAYASHRIBEN MANGE (Co-Borrower) LOAN A/C No. 645911148 And 646006391	Rs.17,85,059/- and Rs.28,705/- respectively as on 31 Dec., 2021*	All That Piece And Parcel Of Immovable Property Being Residential House On Sub- Plot No. 120/8, Of Plot No. 120 (Original Plot No. 120 to 128 Before Amalgamation) Admeasuring Land Area About 63.45 Sq. Mtrs., Along With Construction Standing Thereon Land, Situate, Lying And Being At Revenue Survey No. 427, TPS No. 3/B (Jamnagar-Dhuvav), FP No. 10, Whereby The Individual Plots Are Developed And Known As "Yogeshwar Dham", Situate Within Limits Of Village: Jamnagar, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-registration District: Jamnagar, Within The State Of Gujarat.	Physical Possession	8,60,000/-	86,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	6	MR. MAAN SINGH (Borrower) MRS. GURMEET KAUR (Co-Borrower) LOAN A/C No. 650752514 And 65579866	Rs.13,53,949/- and Rs.47,284/- respectively as on 30 Sep., 2022*	All That Piece And Parcel Of Immovable Property Being Residential House On Sub- Plot No. 296/7, Of Plot No. 296 ( Original Plot No. 296 To 299 Before Amalgamation) Admeasuring Land Area About 48.00 Sq. Mts., Along With Construction Standing Thereon Land, Situate, Lying And Being At Revenue Survey No. 157/1 P, Whereby The Individual Plots are Developed And Known As "Marutinandan", Nr. Balaji Park-3, Situate Within Limits Of Village: Dhinchada, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-registration District: Jamnagar, Within The State Of Gujarat.	Physical Possession	13,50,000/-	1,35,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	7	MR. DILIPBHAI PANKHANIYA (Borrower) MRS. PRABHABEN PANKHANIYA (Co-Borrower) LOAN A/C No. 648652608	Rs.15,66,282/- as on 31 May, 2022*	All That Piece And Parcel Of Immovable Property Being Residential House On Subplot No. 84/2, Of Plot No. 84 (Original Plot No. 84 To 86 Before Amalgamation) Admeasuring Land Area About 50.44 Sq. Mtrs., Along With Construction Standing Thereon Land, Situate, Lying And Being At Revenue Survey No. 94, (Old Revenue Survey No. 37/P2/P2) Whereby The Individual Plots Are Developed And Known As "Shree Kanaiya Park", Nr. Tirupati Park -2, Bedibunder Road, Situate Within Limits Of Village: Dhinchada, Taluka: Jamnagar, District: Jamnagar, Registration & Sub-Registration District: Jamnagar, Within The State Of Gujarat.	Physical Possession	13,65,000/-	1,36,500/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	8	MR. VIJAY DIXIT (Borrower) MRS. LAXMI VIJAY DIXIT (Co-Borrower) LOAN A/C No 619503326 And 620166657	Rs.8,92,561/- and Rs. 45,195/- respectively as on 30 Sep., 2022*	All That Piece And Parcel Of Immovable Property Being Flat No. 302 On 3rd Floor In Tower/ Wing-B, Admeasuring 34.88 Sq. Mtrs. Of Built-up Area, In The Scheme Called "Vardhaman Avenue" Situate, Lying And Being At Revenue Survey No. 140/P & 103, Whereby The Individual Plots Are Developed And Out Of So Many Plots, Plot No. H/32 To H/34 And H/57 & H/58, Situated In The Area Known As "Vardhaman Nagar", Within Limits Of Village: Ghanteshwar (Now Within Limits Of Rajkot Municipal Corporation), Taluka: Rajkot, District: Rajkot, Registration & Sub-registration District: Rajkot, Within The State Of Gujarat.	Physical Possession	8,00,000/-	80,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
	9	MR. ASHISH DILIPBHAI SUCHAK (Borrower) MRS. VARSHA AASHISH SUCHAK (Co-Borrower) MR. MAYURBHAI D. SUCHAK (Co-Borrower) LOAN A/C No. 621447434	Rs.22,73,120/- as on 31 Jan., 2022*	All That Piece And Parcel Of Immovable Property Being Flat No. 102 On 1st Floor, Admeasuring 55.31 Sq. Mtrs. Of Built-up Area, In The Scheme Called "Swastik Complex" Situate, Lying And Being At Revenue Survey No. 201 P, Whereby The Individual Plots Are Developed And Out Of So Many Plots, Plot No. 19 P, Situated In The Area Known As "Lakh No Bunglow", Nr. Ramapir Chowkdi, 150 Ft. Ring Road, Within Limits Of Village: Raiya (Now Within Limits Of Rajkot Municipal Corporation), Taluka: Rajkot, District: Rajkot, Registration & Sub-registration District: Rajkot, Within The State Of Gujarat.	Physical Possession	19,00,000/-	1,90,000/-	3 Oct., 2023 10:30 am to 12:00 pm
L								

\*together with further interest @18% p.a. as applicable, incidental expenses, costs charges etc. incurred up to date of payment and/or realization

The Authorized Officer shall not be responsible for any error, misstatement or omission on the said particulars. The bidders are therefore requested in their own interest, to satisfy themselves with regard to the above and all other relevant details/material facts and information pertaining to the abovementioned immovable properties/secured assets before submitting bids. Statutory dues like property taxes/cess and transfer charges, arrears of electricity dues, arrears of water charges, sundry creditors, vendors, suppliers and other charges known and unknown, shall be ascertained by the bidder beforehand and the payment of the same be the responsibility of the buyer of Property/Secured Asset. Wherever applicable, it is the responsibility of buyer of secured assets to deduct tax at source (TDS) @1% of the total sell consideration on behalf of the resident owner (seller) on the transfer of erty having consideration equal or greater then INR 50,00,000/- and deposit the sane with appropriate authority u/s 194 IA of Income Tax Act, 196

#### Disclosure of Encumbrances

Detailed Terms And Conditions

the best of the knowledge and inf Most Important Terms and Conditions

> Minimum bid increment amount is Rs. 5,000/- (Rupees Five Thousand Only) for Sr. No. 1, 5, 8 and Rs. 10,000/- (Rupees Ten Thousand Only) for Sr. No. 2,3,4,6,7, 9.
> Inspection of all the above mentioned Properties/Secured Assets would from 10 AM till 5 PM, date for inspection of Properties/Secured Assets 4-September, 2023 (Monday).

> For any assistance related to inspection of the property, or for obtaining the E-Auction Bid Document and for any other queries, please get in touch with our authorized partner i.e. M/s. NexXen Solutions Private Limited, having its address at - 203, 2nd Floor, Shree Shyam Palace, Sector 4 & 5, Railway Crossing, Gurugram – 122006, though its Client Service Delivery (CSD) Department on mobile no. +91 9810029926, +91 9310029933, Tel:- +91 124 4233933, e-mail:

CSD@disposalhub.com, or Mr. Umang Shukla or Dhaivat Dholakiya, official of HDFC Bank Ltd through Tel: - 0281-613 6712 or 0281-613 6711. > The last date if submision of bids in the prescribed e-auction Bid documents and EMD in stipulated manner is 28 September, 2023 (Thursday).

For detailed terms and conditions of the sale, please refer to the link provided in HDFC Bank Limited (HDFC) Secured Creditor's website i.e. www.hdfc.com

For, HDFC Bank Ltd.

Date: 26-08-2023 **Authorised Officer** 

Place: Raikot Regd. Office: HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

### યુટ્યૂબ મ્યુઝિકે નવુ એક ફિચર શરૂ કર્યું

# युट्यूभ भ्युजिङे नपुं લાઈવ લિરિક્સ ફીચર શરુ કર્યું

એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ ડિઝાઈન અને વિશેષ ટેક્સ્ટ સાથે અપગ્રેડ લિરિક્સ ફીચર શરુ કરી રહ્યુ છે. જો કે કરવામાં આવી છે. જેમા વધારે અંતર જોવા આ લાઈવ લિરિક્સ એપલના મ્યુઝિકમાં પ હેલાથી જ આપવામાં આવે છે. પરંતુ હવે જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ યુટ્યુબ મ્યુઝિકનો ઉપયોગ કરનારા લોકોને વધી જશે. આ પણ તેનો લાભ મળશે.

ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી ઉપયોગ કરવામાં આવ્યો છે અને યુટ્યુબ ગીત સર્ચ કરવાની મંજૂરી આપે છે.

યુટ્યુબ મ્યુઝિકે હવે ફાઈનલી તેના ૯ થી પ ગુગલના રિપોર્ટ પ્રમાણે નાઉ મ્યુઝિક ચાહકો માટે ગ્લોબલ લેવલ પર પ્લેઈંગમાં રહેલા લિરિક્સ ટેબમાં એક નવી છે. મળે છે. જ્યારે ગીત આગળની લાઈનમાં

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે નવા ફિચરનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગીત આગળની લાઈનમાં જશે પ્રમાણે બેકગ્રાઉન્ડમાં બ્લર કવર આર્ટનો

સુચવવા માટે નોંધનો ઉપયોગ કરવામાં આવે

એન્ડ્રોઈડ વર્જન ૬.૧૫ અને આઈઓએસ **દ.૧૬ માટે યુટ્યુબ મ્યુઝિક પર લાઈવ** લિરિક્સ જાહેર કર્યાના કેટલાય રિપોર્ટ છે.

આ દરમ્યાન ગુગલના માલિકનું યુટ્યુબે જાહેરાત કરી હતી કે આ એન્ડ્રોઈડ પર એક જે યુજર્સને ગુનગુનાકર પ્લેટફોર્મ પર એક

### ઓસ્ટ્રેલિયામાં ભારતીય દંપતીને લઈને ઘટના

# બે બાળકોની કસ્ટડી ગુમાવનારી ભારતીય માતાએ જીવ આપ્યો

એક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા એક ભારતીય દંપતીને પ ોતાના બંને બાળકોની કસ્ટડી ગુમાવવાનો વારો આવતા વ્યથિત માતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રિયદર્શિની પાટીલ નામની આ મહિલા મૂળ કર્જાટકના ધારવાડની વતની હતી, જે પોતાના પતિ સાથે વર્ષો પહેલા સિડની સેટલ થઈ હતી.

પ્રિયદર્શિની તેમજ તેનો પતિ બંને આઈટી એન્જિનિયર હતાં, અને પ્રિયદર્શિનીએ ઓસ્ટ્રેલિયામાં જ એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં જ દ્વારા પ્રિયદર્શિની પાસેથી તેના બંને બાળકોની જન્મેલા હોવાથી પ્રિયદર્શિનીના બંને બાળકો કસ્ટડી પણ છીનવી લેવામાં આવી હતી.

કપલના ૧૭ વર્ષના દીકરાને કોઈ બીમારી ોતાનાથી અલગ કરતી દેતાં પ્રિયદર્શિની ખૂબ થઈ હતી જેની ટ્રીટમેન્ટ ઓસ્ટ્રેલિયામાં જ જવ્યથિત થઈ ગઈ હતી, અને તેણે બાળકોને ચાલી રહી હતી. જોકે. ટીટમેન્ટથી દીકરાની ઈન્ડિયા પરત લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા તબિયતમાં કોઈ સુધારો થવાના બદલે તેની તબિયત વધુ ખરાબ થતાં પ્રિયદર્શિનીએ ડોક્ટર સામે કેસ કર્યો હતો. પરંતુ ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સમ્ન પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના આખરે પ્રિયદર્શિની ૧૮ ઓગસ્ટના રોજ રાખવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ ઈન્ડિયા રિટર્ન થઈ હતી, તેણે બેંગલોરથી નહીં, કાયદાનો હવાલો આપીને સરકાર

ત્યાંના સિટીઝન હતા. રિપોર્ટ અનુસાર, આ ઓસ્ટ્રેલિયાની સરકારે બંને બાળકોને પ

જોકે, નિયમો અનુસાર જે બાળકોની કસ્ટડી સરકાર પાસે હોય તેમને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલવમાં નથી આવતા. પોતાના કોઈ પ્રયાસ સફળ ના થતાં ધારવાડ જવા માટે બસની ટિકિટ બુક કરાવી હતી પરંતુ તે આ બસમાં બેઠી જ નહોતી. ઓસ્ટ્રેલિયાથી બેંગલોર

### ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિચેશનની કાર્ચવાહી

# એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડાઈ

નવી દિલ્હી, તા.૨૬

એવિયેશન (ડીજીસીએ)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી ડીજીસીએના અધિકારીઓએ આપી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે તમામ એરલાઈન્સ નિયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત સુરક્ષા ઓડિટ હેઠળ આવે છે. ડીજીસીએની ટીમે ૨૫ અને ૨૬ જુલાઇએ હરિયાણાના ગુરુગ્રામમાં એર ઈન્ડિયાના કાર્યાલયની મુલાકાત લીધી હતી.

જુદા ક્ષેત્રો જેમ કે કેબિન, નિરીક્ષણ, કાર્ગો, હસ્તાક્ષર નહોતા. રેમ્પ અને લોડમાં નિયમિત સુરક્ષા બાબતોની તપાસ કરવાની હતી પણ ડીજીસીએદ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા જાણ થઈ કે એરલાઈન્સે તમામ ૧૩ કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હતા.

રેકોર્ડિંગ, ઓડિટ સ્ટેટમેન્ટ, શિફ્ટ રજિસ્ટાર દસ્તાવેજ, જીડી (જનરલ ડિક્લેરેશન) યાદી, યાત્રી ઘોષણાપત્રના માધ્યમથી ફરી વેરીફાઈ કરવામાં આવ્યું તો રિપોર્ટ નકલી હોવાની માહિતી મળી. આ ઉપરાંત નિરીક્ષણ સુરક્ષા ઓડિટને અધીન આવે છે.

ડીજીસીએને સોંપાયેલા નિરીક્ષણ રિપ રિપોર્ટમાં જણાવાયું કે આ ફેક તપાસ રિપોર્ટ ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ોર્ટ અનુસાર એરલાઈન્સે સંચાલનના જુદા પર ઉડાન સુરક્ષા પ્રમુખ (સીએફએસ)ના

> ચેક લિસ્ટ પર ક્વૉલિટી મેનેજમેન્ટ સિસ્ટમ વિભાગના એક એકાઉન્ટ સુપ રવાઈઝરના હસ્તાક્ષર હતા જે ડીજીસીએના અનુમોદન અને નિરીક્ષણના દાયરામાં નથી આવતા. આ ઉપરાંત નિરીક્ષણ દળે કહ્યું ડીજીસીએની ટીમે જ્યારે સીસીટીવી, કે એરલાઈન્સ સમયાંતરે ફ્લાઇટ સેફ્ટી ઓડિટર્સની યાદી ઉપલબ્ધ ન કરાવી શકી.

એર ઈન્ડિયા સહિત તમામ એરલાઇન્સ કંપનીઓ ભારત અને વિદેશો બંનેમાં િનયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત

#### જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં જવાનનો હત્યાકાંડ કેસ

# डोन्स्टेजस येतन सिंहनी नार्डो ટેસ્ટની માગની અરજી ફગાવાઈ

ગયા મહિને ૩૧ જુલાઈના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે જયપુર મુંબઈ એક્સપ્રેસમાં તેના એક સીનીયર અધિકારી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદી પ ક્ષે માંગ કરી હતી કે આરોપીના બ્રેઈન મેપિં આવે. મુંબઈની બોરીવલી મેજીસ્ટ્રેટ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, 'આરોપ તપાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું નાદુરસ્ત તબિયતના કારણે તેણે તેની સાથે ીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, 🛾 કે જયારે આરોપીને પોલીસ કસ્ટડીમાં નાર્કો 🔄 રહેલા એએસઆઈપાસે રજા માંગી હતી, પ

ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે તે તેને દબાણ કરી શકીએ નહીં.' માર્યા ગયેલા ટેસ્ટ માટે રાજી થઈ ગયો પરંતુ કોર્ટની સામે લોકોના પરિવારજનોની સંમતિ બાદ ફરિયાદ તેણે ટેસ્ટ માટે ઈક્રાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, પક્ષે કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં કહેવામાં 'આરોપીએ સ્વાસ્થ્યનું કારણ આપીને ટેસ્ટ આવ્યું હતું કે, આરોપીનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન માટે ના પાડી હતી. આરોપી આવો ટેસ્ટ મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પ કરાવવા માંગતો ન હોવાથી અમે તેને દબાણ રવાનગી આપવામાં આવે કારણ કે વ્યક્તિનો કરી શકીએ નહીં.' મુસાફરોની સુરક્ષા માટે ગ અને નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં ગુનો અત્યંત ગંભીર શ્રેણીનો છે. કેસની એક આરપીએફ જવાન ચેતન સિંહ તેના સુનાવણી કરી રહેલા મેજિસ્ટ્રેટે કહ્યું કે, મને સાથીદારો સાથે ટ્રેનમાં તૈનાત હતો. જ્યાં

### વહેલી સવારે દારૂનો જથ્થો આવ્યો અને કટીંગ કરતા સમયે જ સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકી

# વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનની હૃદમાં SMC नो हरोडो, सासु सिंधी सिंहत ८ पोन्टेड

વડોદરા,તા.26

વારસિયામાં આજે કુખ્યાત બુટલેગર આવીહતી. લાલુ સિંધી દ્વારા મંગાવવામાં આવેલા દારુના જથ્થાનું વહેલી સવારે કટીંગ ચાલી રહ્યું હતું. તે સમયે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂપિયા 5.80 લાખનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 5 વાહનો મળી રૂપિયા 23 લાખનો મુદામાલ કબજે લાલુ સિંધી સહિત 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. બનાવને પગલે વારસીયા પોલીસ ગયાહતા. સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધવામાં

પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ ગોપાલ મનોહરલાલ નથવાણી,વિનોદ શહેરમાં દારુ વેચાણ માટે જાણીતા કર્મીઓની તાત્કાલીક બદલી કરી દેવામાં તહેલારામ

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલને શહેરના વારસિયા ગયાહતા. વિસ્તારમાં આવેલા દારુના જથ્થાનું ગાયત્રીસોસાયટીપાસે આવેલામેદાનમાં કટીંગ થઇ રહ્યું છે. જે માહિતીના આધારે SMC એ દરોડો પાડ્યો હતો. SMC એ યોજનાબધ્ધ રીતે દરોડો પાડતા દારુ લેવા કર્યો હતો.પોલીસે આ બનાવમાં સુત્રધાર માટે આવેલા બુટલેગરોના માણસોએ દોડધામ કરી મૂકી હતી. કેટલાંક લોકો પોતાના વાહનો સ્થળ પર મૂકીને ફરાર થઇ

આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,થોડા સમય પાડ્યો ત્યારે બે બોલેરો પિકઅપમાંથી પહેલવાણી સહિત બે બોલેરો પિકઅપના પહેલા પણ વારસીયા પોલીસ સ્ટેશનની દારુનો જથ્થો ઉતારીને કાર તેમજ માલિક,કેટા કારનો માલિક,એક ઓટો પાડ્યોહતો.જોકે આરેઇડબાદવારસીયા પરથી વારસિયા વિસ્તારમાં રહેતો કર્યાછે.

જગ્યાસી,શીતલદાસ મૂળચંદાની તેમજ આજવારોડ એકતા નગરમાં રહેતો અનવર મન્સૂરી ઝડપાઇ

સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી 5,80,000 નો દારુનો જથ્થો તેમજ 4 ઓટો રીક્ષા,એક કાર,બે પિકઅપ ટેમ્પો, તેમજ એક ટુ વ્હિલર, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ્લે રૂપિયા 23,37,030 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં દારુનો જથ્થો મંગાવી ડિલીવરી કરી રહેલા કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાની,મુકેશ SMC એ બાતમીના આધારે દરોડો મખ્ખીજાની,ગિરીશ ઉર્ફે ગિરી સેવકલાલ હદમાં એસ.એમ.સીએ રેઇડ કરી ચાર જેટલી રિક્ષામાં ભરવામાં આવી રિક્ષાનો માલિક તેમજ દારૂ મોકલનાર લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી રહ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ એમ મળીને કુલ 9 શખ્સોને વોન્ટેડ જાહેર

### કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની સુપ્રીમમાં અરજી ટ્રાન્સઝેન્ડરને નોકરી-શિક્ષણમાં અનામત : કેન્દ્ર-રાજ્યોને નોટિસ

કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ માંગ્યો છે.

શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર નોકરીઓમાં ટાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અનામતની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ૫ છે. ાઠવી છે. કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતી વખતે સીજેઆઈ ડીવાયચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો. સમાન અરજીના જવાબમાં, કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું હાલની અનામતનો લાભ મેળવી શકાય છે. વામાં આવે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સચિવે એક એફિડેવિટ દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે એસસી/ એસટી/એસઈબીસીસમુદાયના લોકો પ હેલાથી જ આરક્ષણ માટે હકદાર છે. આ સિવાય ૮ લાખ રૂપિયાની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા અન્ય કેટેગરીના ટ્રાન્સજેન્ડરોને પણ ઈડબલ્યુએસકેટેગરી હેઠળના આરક્ષણમાં સામેલ કરવામાં આવ્યા

સીજેઆઈચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૂછ્યું કે શું બંધારણની કલમ ૧૪, ૧૯ અને ૨૧ હેઠળ ટ્રાન્સજેન્ડર્સને અનામત ન આપવું જોઈએ? આ અરજી સુબી કેસી નામના ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરોને કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા નોકરીઓમાં પણ સરકારી નોકરીઓમાં અનામત આપ

કેટલાક ધારાસભ્યોના જવાથી પક્ષ તૂટ્યો નથી : શરદ પવાર

ાર્ટી તૂટવાનો ઈક્રાર કર્યો છે. તેમણે કહ્યું કે, આપી હતી. તેમણે કહ્યું હતું કે, હા... આમાં કેટલાક ધારાસભ્યો પાર્ટીમાં જતા રહ્યા છે, પરંતુ એકલા ધારાસભ્યોના જવાનો મતલબ એ નથી કે, આખી રાજકીય પાર્ટી તુટી ગઈ ીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ ૮ અન્ય એનસીપી ધારાસભ્યોએ પક્ષમાં ક્ષ સાથે બળવો કરનારા નેતાઓ પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છો ? જેના જવાબમાં

તેમને મહત્વ કેમ આપવામાં આવે. અગાઉ શરદ પવારની પુત્રી અને પક્ષની કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ કહ્યું હતું

કે, એનસીપીમાં ભંગાણ પડ્યું નથી અને પ વાત કરતા કહ્યું કે, આ મિશન આપણા માટે રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી - એનસીપીના ક્ષના નેતા અજિત પવાર જ યથાવત્ રહેશે... મોટી સફળતા છે... ભારતીય અવકાશ પ્રમુખ શરદ પવારે આજે ફરી પોતાની પ આ બાબતે શરદ પવારે પણ પ્રતિક્રિયા

એનસીપીમાં ભંગાણ પડ્યાનો ફરી શરદ પવારનો ઈનકાર

કોઈપણ વિવાદ નથી... પરંતુ કેટલાક કલાકો બાદ પવારે યુટર્ન લીધો અને કહ્યું, તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. ઉલ્લેખનિય હોય... પવારે વધુમાં કહ્યું કે, હું એનસીપ છે કે, ર જુલાઈના રોજ અજિત પવાર અને મહારાષ્ટ્રમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ છે. જ્યારે બળવો કર્યો હતો અને મહારાષ્ટ્રમાં એકનાથ શરદ પવારને પૂછવામાં આવ્યું કે, શું તમે ૫ શિંદેની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં આ ધમાસાણ બાદ રાજકારણ તેમણે કહ્યું કે, બળવાખોરોના નામો બોલી પણ ગરમાયું હતું. અજિત પવારે બળવો કર્યા બાદ પક્ષ પર પોતાનો દાવો કરી ચૂંટણી પંચને

> પત્ર લખ્યો હતો. શરદ પવારે ચંદ્રયાન-૩ મિશન બાબતે તે ખબર નથી.

સંશોધન સંસ્થા - ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ. વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકોને મળવા પ્રોટોકોલ તોડી ઈસરો કંટ્રોલ સેન્ટર ગયા, જોકે ઠીક છે... તેમણે મોદીની ટીકા કરતા કહ્યું કે, તેઓ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ઈચ્છતા નથી, માત્ર લોકસભા ચૂંટણીનું જ વિચારે છે. તેઓ 'જનમત' (લોકોના પ્રતિભાવ) જાણવા માંગતા નથી.

અજિત પવાર જૂથમાં સામેલ થનાર એનસીપી નેતા હસન મુશ્રીફ અંગે પવારે કહ્યું કે, તેઓ ઈડીના દરોડાનો સામનો કરી રહ્યા હતા, જોકે હવે કાર્યવાહી બંધ થઈ ગઈ છે... આ માટે તેમણે કોની સાથે વાતચીત શરૂ કરી

# ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા સીઆરપીએફના જવાનોને સુચના

સેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સુચના આપવામાં આવી છે. સીઆરપીએફએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન કે, આ રીતે તેમને હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવી શકે છે. જારી કરવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, એવું સામે આવ્યું છે કે, ઘણા જવાનો પોતાના

યુનિફોર્મમાં વીડિયો અને ફોટો અપલોડ કરે છે. આ ઉપ મીડિયાને લઈને કડક સુચના આપવામાં આવે છે કે, રાંત અનેક લોકોને ચેટ મેસેજ પણ મોકલાવે છે. કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ અલગ-અલગ અર્ધલશ્કરી દળો અને પોલીસ ફોર્સને લેટર જારી કર્યો છે. સીઆરપીએફએ આ 🕏 ફેન્ડ લિસ્ટમાં સામેલ ન કરવા. જો આ નિર્દેશોનું પાલન 🛭 ડ્યૂટી સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ બાબતને ગંભીરતાથી લેતા પોતાના જવાનો માટે નિર્દેશ કરવામાં નહીં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સોશિયલ મીડિયા પર કોઈ પણ સંવેદનશીલ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ જારી કર્યો છે અને કહ્યું કે, તેઓ યૂનિફોર્મમાં પોતાના આવી જ રીતે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડાએ વીડિયો કે ફોટો અપલોડ ના કરે અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરે.

એક સત્તાવાર નોટમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી.

યૂનિફોર્મમાં ફોટો અને વીડિયો અપલોડ ના કરવાની સાથે જ યોગ્ય તપાસ કર્યા વગર કોઈને પણ પોતાના પણ લેટર જારી કરીને કહ્યું છે કે, ધકપકડ કરાયેલ વ્યક્તિ દળોને પણ સોશિયલ મીડિયા ગાઈડલાઈન જારી કરી છે અથવા અંડર ટ્રાયલ વ્યક્તિ સાથે સબંધિત કોમેન્ટ અને સરહદ પર તૈનાત જવાનોને રીલ્સ ન બનાવવા માટે

હાઈલી પ્રોટેક્ટેડ વિસ્તારોમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ ના કરે. તેમણે એમ પણ કહ્યું કે, જાણકારી શેર ન કરવી. આ ઉપરાંત અન્ય અર્ધલશ્કરી જણાવ્યું છે.

## બાંદીપોરમાં શંકાસ્પદ હિલચાલ બાદ કાર્ચવાહી આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના સંદર્ભે મહિલા-આતંકી ઝડપાચા

સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ધરપકડ કરી છે. શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો.

તે જ સમયે, આ કેસમાં એક આતંકવાદી અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને બનાવવાના કાવતરામાં સામેલ સ્થાનિક આતંકવાદી તૈયાર થઈ રહ્યું છે.

અને માર્યા ગયેલા આતંકવાદીની પત્ની મુનીરા બેગમની

સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર કર્યો છે. આ બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા.

મીરે પોતે હથિયાર અને પૈસા મોકલ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને તેમની સિસ્ટમથી જાણ કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોએ આતંકવાદી નેટવર્ક થઈ હતી કે બાંદીપોરામાં એક નવું આતંકવાદી નેટવર્ક

## વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

હિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી હજારો ટૂકો રસ્તાઓ પર ફસાઈ ગયા છે.

ભારે વરસાદને પગલે રસ્તાઓ બંધ હોવાથી આવી રહ્યો છે.

બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાઈ ગઈ છે. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર છે. લેહ એરપોર્ટના રનવેનું કામ, તાંગસે અને અઘમથી મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત ચીન સરહદ સુધી બનાવવામાં આવી રહેલા રસ્તાઓ અનેક રસ્તાઓ છેલ્લા ૧૫ દિવસથી બંધ છે. આ કારણે 🔝 પર ખરાબ અસર પડી છે. આ સિવાય તાંગસેથી ચીન સરહદ સુધી ૨૨ કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં

#### જીંદાલ હોટેલ્સ લિમિટેડ

CIN: L18119GJ1984PLC006922 पडोहरा-3600२0. होन: 0२९५-२३९३३९९ / २२२९०४४ / २२२९०००

થી નોકરી મેળવનારા ફાયર વિભાગના આઠને नोटिस

બોગસ

સ્પોન્શરશિપ

અમદાવાદ, ફાયર વિભાગમાં **પણ બોગસ સ્પ** <del>.</del>ન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ

તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી. દરમિયાન વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો પણ નિર્ણય મ્યુનિ.તંત્ર તરફથી કરવામા આવતો હતો.બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે અમદાવાદ

ફાયર વિભાગમાં નોકરી મેળવનારા આઠ અધિકારીઓને મ્યુનિ.તંત્રે શો-કોઝ નોટિસ ફટકારી છે.બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો

જવાબ કરવા આદેશ

કરાયો છે.

રજી. ઓફિસ : ગ્રાન્ડ મરકચોર વડોદરા સુર્યા પેલેસ, સચાજીગંજ, Email ID: share@suryapalace.com Website: www.suryapalace.com સૂચના 📉

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની લાગુ પડતી તમામ જોગવાઈઓ અને તેના હેઠળ બનાવેલા નિયમો; સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ('સેબી') (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ને સાથે વંચાણમાં લેતા મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ) દ્વારા તા.૮મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાચેલા સામાન્ય પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦, તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર નંબર ૧७/૨૦૨૦, તા. પમી મે, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર નંબર ૨૦/૨૦૨૦, તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ ના સામાન્ય પરિપત્ર નંબર ૦૨/૨૦૨૧, તા. પમી મે, ૨૦૨૨ ના પરિપત્ર નંબર ૦૨/૨૦૨૨ અને તા. સ્ટમી ડિસેમ્બર, ૨૦૨૨ ના પરિપત્ર નંબર ૧૦/૨૦૨૨ તેમજ એમસીએ અને સેબી દ્વારા જારી કરાચેલ અન્ય લાગુ પડતા પરિપત્રો ('સંબંધિત પરિપત્રો') ના પાલન અને અન્ય બાબતો અર્થે, કંપનીની આડત્રીસમી વાર્ષિક સામાન્ય સભા ('એજીએમ') વિડીયો કોન્ફરંસીગ / અન્ય દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ (ઓએવીએમ) દ્વારા મંગળવાર તા. ૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૪.૩૦ વાગ્ચે નોટીસમાં જણાવેલ બાબતોનો વ્યવહાર કરવા માટે ચોજાશે. સભ્યો (વીસી/ઓએવીએમ) દ્વારા સભામાં હાજર રહી શકશે. વીસી/ઓએવીએમ ની સુવિધા દ્વારા સભામાં હાજર રહેનારા સભ્યોની કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કોરમમાં

સંબંધિત પરિપત્રોના પાલન અર્થે, જે સભ્યોના ઈમેઈલ સરનામાઓ કંપની / ડિપોઝિટરી પાર્ટીસિપન્ટસ સાથે નોંધાયેલા છે તેમને સભાની નોટીસ અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના સ્ટેન્ડઅલોન ફાઈનાન્સીયલ સ્ટેટમેન્ટ; બોર્ડનો અહેવાલ, ઓડિટર્સ રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત મોકલવામાં આવશે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.suryapalace.com પર અને સ્ટોક એક્સચેંજ એટલે કે બીએસર્ઇ લિમિટેડની વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ રહેશે.

ઈ-મતદાન દ્વારા મતદાન કરવાની રીત :

(એ) સભ્યોને એજીએમની નોટીસમાં જણાવેલ બાબતો માટે ઈલેકટ્રોનિક મતદાન પ્રણાલી ("ઈ-વોટિંગ") દ્વારા પોતાનો મત આપવાની તક મળશે. (બી) જે સભ્યો ડીમટીરીચાલાઈઝ્ડ સ્વરૂપમાં, કે ભૌતિક (ફિઝિકલ) સ્વરૂપમાં શેર ધરાવે છે અને

જે સભ્યોએ તેમના ઈમેઈલ સરનામાં નોંધાવ્યા નથી તેવા સભ્યોને અન્ય સ્થળેથી રિમોટલી

મતદાન કરવાની રીત (રિમોટ ઈ-વોટીગ) એજીએમ નોટીસમાં આપવામાં આવી છે. આ વિગતો કંપનીની વેબસાઈટ www.suryapalace.com પર ઉપલબ્ધ હશે. (સી) ઈલેકટ્રોનિક મતદાન પ્રણાલી દ્વારા મતદાન કરવાની સુવિધા એજીએમમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને રિમોટ ઈ-મતદાન દ્વારા પોતાનો મત નહી આપનારા એજીએમમાં

હાજર રહેલા સભ્યો એજીએમમાં મત આપી શકશે. ઈમેઈલ સરનામાંઓ નોંધણી/અપડેટ કરવાની રીત :

(એ) ભૌતિક (ફિઝિકલ) સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો, જેમણે કંપની પાસે તેમના र्धमेर्धत सरनामां नोंधाव्या नथी /अपडेट डर्या नथी, तेओने https://linkintime.co.in/EmailReg/Email\_Register.html પર કંપનીના રિજસ્ટ્રારની વેબસાઈટ પર અથવા તેમને <u>vadodara@linkintime.co.in</u> પર લખી અને ફોલિયો નં. ની વિગતો અને પાનકાર્ડની સ્વયં પ્રમાણિત નકલ અપલોડ /જોડવાની विनंती छे

(બી) ડિમટીરિચલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા જે સભ્યોએ તેમના ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટસ પાસે તેમના ઈમેઈલ સરનામાંઓ નોંધાવ્યા નથી/અપડેટ કર્ચાનથી,તેઓને જયાં તેમના ડિમેટ એકાઉન્ટ્સ છે એવા ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટસ પાસે તેમના ઈમેઈલ સરનામાં નોંધણી/અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે.

સભ્યોને સભાની નોટીસમાં જણાવેલ તમામ નોંધોને અને ખાસ કરીને, સભામાં જોડાવા માટેની સૂચનાઓ, રિમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા સભા દરમિયાન ઈ-વોટિંગ દ્વારા મતદાન કરવાની રીત કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે.

સ્થળ : વડોદરા તારીખ ઃ ૨૫.૦૮.૨૦૨૩ જીંદાલ હોટલ્સ લિમિટેક વતી માનસી વ્યાસ કંપની સેકેટરી

### તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ CIN: L24232GJ1996PLC029894

**૨૭૨૮ર્ડ ઓફિસ :** પ્લોટ નં.૫૦૨ / ૧૭, જીઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર, જિલ્લો : ભરૂચ, ગુજરાત-૩૯૩ ૦૦૨. **จัดลายัง:** www.tatvachintan.com **ย์-มัยัด:** cs@tatvachintan.com **ટેલીફોન નંબર:** +૯૧ ૭૫૭૪૮ ૪૮૫૩૩ ફેક્સ: +૯૧ ૨૬૫ ૨૬૩૮૫૩૩

#### ર૭મી વાર્ષિક સાધારણ સભાની સૂચના, રેકોર્ડ કેટ, બુક ક્લોઝર તેમજ રીમોટ ઈ-વોર્ટીંગની માહિતી

આથી સૂચના આપવામાં આવે છે કે :

૧. તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ ("ઘી કંપની") ના શેરધારકોની સત્તાવીસમી ("૨૭મી") વાર્ષિક સાધારણ સભા ("એજીએમ") શુક્ર**વાર, તારીખ રસ્મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજે ૪-૦૦ કલાકે (આઇએસટી)** વિડીયો કોન્ફરન્સીંગ ('વીસી')/અન્ય ઓડિયો-વિઝયુઅલ સાધનો ('ઓએવીએમ') દ્વારા યોજાશે. આ સભા, કોર્પોરેટ બાબતોના મંત્રાલય **("એમસીએ")** દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ ૨૦૨૦, ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ ૨૦૨૦, ૨૦/૨૦૨૦ તા. પર્મી મે ૨૦૨૦, અને આ અંગેના અન્ય પરિપત્રો, તાજેતરના તા. ૨૮મી ડિસેમ્બર ૨૦૨૨ ના સામાન્ય પરિપત્ર નં. ૧૦/૨૦૨૨ અને સમયાંતરે અન્ય લાગુ પડતા તમામ પરિપત્રો, જો કોઇ હોય તો, અને સીકયુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા ("સેબી") દ્ભારા સમયાંતરે બહાર પાંડવામાં આવેલ પરિપત્ર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તા. પમી જાન્યુઆરી ૨૦૨૩ (અત્રે હવે પછીથી જે એકત્રિત રીતે **"પરિપત્રો"** તરીકે સંદર્ભિત થશે), કે જેના થકી કંપનીઓને સઠુ માટે કોઇ એક સ્થળે સદસ્ચોની હાજરી વગર વીસી / ઓએવીએમ ના માદચમથી વાર્ષિક સાધારણ સભા ચોજવાની મંજુરી આપવામાં આવી છે, તેના હેઠળ ચોજવામાં આવેલ છે. આથી, કંપનીની ૨૭મી વાર્ષિક સાધારણ સભા, તા. ૦૪થી ઓગષ્ટ ૨૦૨૩ની કંપનીની ૨૭મી વાર્ષિક સાધારણ સભા ચોજવાની સંચનામાં નિર્ધારેલ વ્યવસાયોના વ્યવહાર માટે, વીસી / ઓએવીએમ દ્ભારા યોજવામાં આવી છે. જે સદસ્યો વીસી / ઓએવીએમ દ્ભારા આ સભામાં ભાગ લેશે તેમની કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ ફેઠળ કોરમના દેતુસર ગણના કરવામાં આવશે.

સંબંધિત ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરતા, રહમી વાર્ષિક સાધારણ સભાની સૂચના અને વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના વાર્ષિક અહેવાલની ઈલેકટ્રોનીક નકલ, એવા તમામ સદસ્યોને મોકલવામાં આવેલ છે જેમના ઈ-મેઈલ સરનામાં કંપની / રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ ("RTA") / કિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ ("DPs") સાથે નોંધાચેલા છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.tatvachintan.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ અનુક્રમે બીએસઈ લિમિટેડ ("બીએસઈ") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ ("એનએસઈ") ની વેબસાઈટ <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> તથા એજીએમ અને વીસી ની પ્રક્રિયા દરમ્યાન રીમોટ ઈ-વોટીંગ માટે નિયુકત કરવામાં આવેલ એજન્સી, લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ("LIIPL") ની વેબસાઈટ https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ છે. આ સૂચના પાઠવવાની કામગીરી ઈ-મેઈલ દ્વારા **૨૬મી ઓગસ્ટ ૨૦૨૩** ના રોજ

વાર્ષિક અહેવાલની વેબ લિંક:

https://www.tatvachintan.com/wp-content/uploads/2023/08/Tatva-Chintan-AR23\_Web-upload-PDF.pdf આ સાથે સૂચના આપવામાં આવે છે કે સમચાંતરે સુધારા કરાચેલ કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૯૧(૧) અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્કલોઝર રીકવારમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૨ અનુસાર, કંપનીનું રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક **શનિવાર, હમી સપ્ટેમ્બર ૨૦૨૩ થી શુક્રવાર, ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૩ (બંને દિવસ સહિત)**, ૨૭મી એજીએમના હેતું માટે બંધ રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટેના અંતિમ ડિવિકંડ મેળવવા પાત્ર થતા શેરધારકોના નામ નકકી કરવાના હેતુ માટે રેકોર્ડ કેટ શુક્રવાર, ૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ છે. જો ડિવિકંડ, એજીએમમાં જાહેર કરવામાં આવશે તો, સ્ત્રોત પર આવક-વેરાની કપાતને આઘીન ચૂકવવામાં આવશે.

સમયાંતરે સુધારા કરાયેલ કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અને ધી કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ-૨૦ સાથે વાંચતા અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સે, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૪ પ્રમાણે, કંપનીના શેરધારકો માટે નીચે જણાવેલી જાણકારીઓ ઉપલબ્ધ છે :

કટ ઓફ ડેટ શુક્રવાર, ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ભૌતિક સ્વરૂપમાં કે ડીમટીરીયલાઈઝડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો તારીખ જથી ઓગષ્ટ ૨૦૨૩ની રહમી એજીએમની સૂચનામાં દર્શાવેલ વ્યવસાયો પર તેમનો ઈલેકટ્રોનીકલી મત લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ("LIIPL") https://instavote.linkintime.co.in ની ઈલેક્ટ્રોનીક વોટીંગ પ્રણાલી મારફતે આપી શકશે. આથી તમામ સદસ્યોને જણાવવામાં આવે છે કે :

રહમી એજીએમ, તારીખ જથી ઓગષ્ટ ૨૦૨૩ની સૂચનામાં નિધરિલ વ્યવસાયોનો વ્યવહાર રીમોટ ઇ-વોટીંગ અને એજીએમ ખાતે ઈ-વોટીંગ પ્રણાલી મારફતે કરવામાં આવશે;

રીમોટ ઇ-વોટીંગનો પ્રારંભ મંગળવાર, ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારના ૯.૦૦ કલાકે (આઇએસટી) થશે; રીમોટ ઇ-વોટીંગ ગુરૂવાર, ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજના ૫.૦૦ કલાકે (આઇએસટી) પુરું થશે;

રીમોટ ઈ-વોટીંગ અને / અથવા વાર્ષિક સાધારણ સભામાં ઈ-વોટીંગ સિસ્ટમથી મતદાન કરવા માટેની પાત્રતા નકકી કરવા માટેની

કટ ઓફ કેટ શુક્રવાર, ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૩ રહેશે; કોઇપણ વ્યક્તિ, કે જે એજીએમની નોટીસ પાઠવ્યા પછી કંપનીના ઇકવીટી શેર મેળવે છે અને કંપનીનો સભાસદ બને છે અને કટ ઓફ ડેટના રોજ ઇકવીટી શેરધારક છે, તે ૨૭મી વાર્ષિક સાધારણ સભાની તારીખ જથી ઓગષ્ટ ૨૦૨૩ ની સૂચનામાં આપેલ ૨૫ નંબરની નોંધ મુજબ લોગઇન આઇડી અને પાસવર્ડ મેળવી / બનાવી શકે છે.

સદસ્યો નોંધ લઇ શકે છે કે : LIIPL દ્વારા રીમોટ ઇ-વોટીંગ વ્યવસ્થા ગુરૂવાર, ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજના ૫.૦૦ કલાકે (આઇએસટી) નિષ્ક્રિય કરવામાં આવશે અને એકવાર ઠરાવ પર મત આપી તે સદસ્ય દ્વારા તે કન્ફર્મ કરવામાં આવે તે પછી, સદસ્યો તેમાં કેરકાર કરી શકશે નહીં:

એજીએમ દરમ્યાન પણ ઇ-વોટીંગ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે અને જે સભાસદો વીસીના માદયમથી એજીએમમાં ઉપસ્થિત હશે અને જેમણે રીમોટ ઇ-વોટીંગની સુવિદ્યા હેઠળ ઠરાવો પર મતદાન કર્યુ નથી અને જેઓ અન્ય કોઇ રીતે મતદાન માટે પ્રતિબંધિત નથી, તેઓ એજીએમ માં ઇ-વોટીંગથી મતદાન કરવા માટે પાત્ર ગણાશે;

એજીએમ પહેલા જે સભાસદોએ રીમોટ ઇ-વોટીંગ થી મતદાન કરી લીધું છે તેઓ એજીએમમાં હાજરી આપી શકશે, પરંતુ ફરીથી મતદાન કરી શકશે નહીં: કટ ઓફ ડેટના રોજ જે વ્યક્તિનું નામ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સમાં અથવા ડીપોઝીટરી દ્વારા રાખવામાં આવતા રજીસ્ટર ઓફ બેનીફિશ્યલ ઓનર્સમાં નોંધાચેલું હશે, માત્ર એવી વ્યક્તિઓને જ રીમોટ ઇ-વોટીંગની અને/ અથવા એજીએમમાં

ઈ-વોરીંગની સુવિધાનો ઉપયોગ કરવાનો અને એજીએમમાં ભાગ લેવા માટેનો અધિકાર રહેશે. પાં. જે સભાસદો ડીમટીરીયલાઇઝડ કે ભેોતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અને એવા સભાસદો જેમણે તેમના ઇ-મેઇલ સરનામાંની નોંધ કરાવી નથી તેમના માટે રીમોટ ઇ-વોટીંગ કરવાની પદદ્યતિની એજીએમની સૂચનામાં જાણ કરવામાં આવી છે. આ વિગતો કંપનીની

વેબસાઇટ <u>www.tatvachintan.com</u> પર ઉપલબ્ધ છે. ઈલેકટ્રોનીક માધ્યમથી મતદાન કરવાની સુવિધા સાથે જોડાયેલી તમામ ફરિયાદો શ્રી રાજીવ રંજન, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ. લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, સી-૧૦૧, ૨૪૭ પાર્ક, વિક્રોલી વેસ્ટ, મુંબઈ - ૪૦૦ ૦૮૩ ને સંબોધવામાં આવી શકે છે

અથવા <u>enotices@linkintime.co.in</u> પર ઈ-મેઈલ મોકલી શકાય છે અથવા ટેલીફોન : ૦૨૨-૪૯૧૮૬૦૦૦ પર કૉલ કરી શકાય છે. કંપનીએ ન્યાચી અને પારદર્શક પદ્ધતિથી ઈ-વોટીંગ પ્રક્રિયાને સ્ક્રુટિનાઈઝ કરવા, સ્ક્રુટિનાઈઝર તરીકે મેસર્સ ટીએનટી એન્ડ

એસોસિએટસ, પ્રેકટીસીંગ કંપની સેક્રેટરીઝ, વડોદરા ની નિયુકિત કરી છે. ઈ-મેઈલ સરનામાં અને બેંક ખાતાની વિગતો નોંધણી / અપડેટ કરવાની રીત: ભૌતિક સ્વરૂપમાં શેર ઘરાવતા સદસ્યો, કે જેમણે કંપની પાસે પોતાના ઈ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો નોંધાવેલ/ સુધારો કરી નથી, તેમને પોતાના ઇ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો તેમના ફોલિચો નંબર દર્શાવતો તથા પાન, આધાર કાર્ડ, કેન્સલ કરેલ ચેકની સ્વ-પ્રમાણિત નકલો સાથેનો ઈ-મેઈલ, કંપનીના રજસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ, લિંક ઈનટાઈમ ઈન્ડિયા

પ્રાઈવેટ લિમિટેડ ને <u>vadodara@linkintime.co.in</u> પર મોકલીને નોંધાવવાની / સુધારો કરાવવાની વિનંતી કરવામાં આવે છે. ડીમટીરીયલાઈઝડ સ્વરૂપમાં શેર ધરાવતા સદસ્યો, કે જેમણે ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ પાસે પોતાના ઈ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો નોંધાવેલ / સુધારો કરી નથી, તેમને તેઓ તેમના ડિમેટ ખાતાઓ જેમની સાથે જાળવી રાખે છે તે ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ સાથે પોતાના ઈ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો નોંધાવવાની / સુધારો કરાવવાની વિનંતી કરવામાં આવે છે.

ડીમેટ મોડમાં સિક્યોરિટીઝ ધરાવતા વ્યકિતગત શેરધારકો માટે हેલ્પડેસ્ક : ડીમેટ મોડમાં સિક્ચોરિટીઝ ધરાવતા શેરધારકો ⁄ સભ્યોને ડિપોઝીટરી એટલે કે NSDL / CDSL દ્વારા લોગિન સંબંધિત કોઈ પણ તકનીકી મમસ્યાઓ હોય તો તેઓ નીચે આપેલા સંબંધિત હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે :

ફિઝિકલ મોડમાં સિકયોરિટીઝ ધરાવતા શેરધારકો / સભ્યો / સંસ્થાકીય શેરધારકોને ઈ-વોટીંગ અંગે કોઈ પ્રશ્નો હોય તો તેઓ

લોગઈન પ્રકાર હેલ્પડેસ્ક વિગતો NSDL સાથે ડીમેટ મોડમાં લોગઇનમાં કોઈપણ તકનીકી સમસ્યાનો સામનો કરતા સભ્યો <u>evoting@nsdl.co.in</u> પર વિનંતી સિકચોરિટીઝ ધરાવતા મોકલીને NSDL હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવા ૦૨૨-૪૮૮૬૭૦૦૦ અને

વ્યકિતગત શેરધારકો ૦૨૨-૨૪૯૯૭૦૦૦ પર કૉલ કરી શકે છે. CDSL સાથે ડીમેટ મોડમાં | લોગઇનમાં કોઈપણ તકનીકી સમસ્યાનો સામનો કરતા સભ્યો સિકચોરિટીઝ ધરાવતા helpdesk.evoting@cdslindia.com પર વિનંતી મોકલીને CDSL हેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૨૨૫૫૩૩ પર સંપર્ક કરી શકે છે.

ફિઝિકલ મોડમાં સિકચોરિટીઝ ધરાવતા વ્યકિતગત શેરધારકો / સંસ્થાકીય શેરધારકો માટે હેલ્પડેસ્ક :

nttps://instavote.linkintime.co.in પર હેલ્પ સેકશન હેઠળ ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને ઈન્સ્ટાવોટ ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈશકે છે અથવા <u>enotices@linkintime.co.in</u> પર ઈ-મેઈલ મોકલી શકે અથવા ટેલિફોન: ૦૨૨-૪૯૧૮૬૦૦૦ પર સંપર્ક કરી શકે છે. બોર્ડના આદેશથી તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ વતી

ારીખ : ૨૬મી ઓગસ્ટ ૨૦૨૩

કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર એમ.નં.: એ૩૭૪૪૪